

## ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રક્રોતારી

[ ૩૨ ]

૧. વિશ્વવિદ્યાલયમાં બોધભાષા કઈ હોની જોઈએ એ પ્રશ્નો ઉત્તર દુનિયાનાં અધ્યાત્મ અનુભવી અને પુરાતન વિશ્વવિદ્યાલયો આપી રહ્યા છે. ટાગોર તેમ જ ગાંધીજી જેવા પ્રાચ્યો એ ઉત્તર અસંદિઘપણે આપી ગયા છે. વળી, બબા જ જન્મસિદ્ધ ડેળવણીકારો મુક્તાકે ઉત્તર આપે છે. તેમ છતાં બોધભાષાનો પ્રશ્ન જીબો કર્યો એ તો આણકની સાચી ભાતા એને જન્મ આપનાર કે એને ઉછેરનાર નોકરાણી—એના જેવું અસ્થાને છે. બોધભાષા સહજ રીતે પહેલેથી છેલ્ખે સુધી ભાતભાષા જ હોઈ શકે; એ વિશે સદ્ગુરુ સેવા એ પોતાની જત વિશે સદ્ગુરુ સેવા જેવું છે. આ વસ્તુ શૈક્ષણિક પ્રોગ્રામી દીવા જેણી સ્પષ્ટ છે.

૨. હિંદીનું સ્થાન રાષ્ટ્રીય ભાષા કેંદ્રે માધ્યમિક શાળામાંથી જ શરૂ થાય છે, તે વિશ્વવિદ્યાલયમાં ઠેડ સુધી યથાયોજ અનિવાર્ય અને એ પરતું છે. એટલા પાયા ઉપર હિંદીન્શાનતું પૂરું ચચુતર સરલ અને શક્ય છે.

૩. વિશ્વવિદ્યાલયોમાં અંગેજ અધી રીતે સમર્થ અને ઉપયોગી એક ભાષા કેંદ્રે શીખવાય જ. તેમ છતાં જેઓ એનો બોને સહી ન શકે અને ભાત્ર વિષયોના જ્ઞાનાર્થી હોય તેવાએ ઉપર તેનું અનિવાર્ય બંધન હિંદીની પેઢે ન રહે. છેવટે હિંદી એ ડેઈ પણ હિંદી ભાષાથી અંગેજ કરતાં અનેકગણી નજીક છે.

૪. સ્વભાવનાર અધ્યાપકો પોતપોતાના વિષયમાં આધ્યમિક અને છેલ્ખી માહિતીવાળાં પુસ્તકો સહેલાએથી લખી શકે. આ રીતે અધી જ પ્રાદેશિક ભાષાઓમાં અનેક વિષયો ઉપર અનેક પુસ્તકો જ્યાયાખંડ તૈયાર થવાના. હિંદીમાં પણ થવાના, એમાં જે જે વધારે ઉત્તમ ડાટિનાં હશે તે જ મુખ્યપણે ધ્યાન બેચવાનાં, અને અન્ય પ્રાન્તીય ભાષાઓમાં તે હિંદીમાં તેના અનુવાદ પણ થવાના. એટલે અનેક પ્રાન્તીય ભાષાઓના સહજ વિકાસ અને પરિણામરૂપે લાધીલી સામચ્ચી હિંદી ભાષામાં પણ આવવાના. ભાત્ર એકલી હિંદી ભાષા દ્વારા એવું પરિણામ લેના સુખુતો પણ આણી ન શકે. એટલે છેવટે તો હિંદી ભાષાના કાડામાં આનતરિક પ્રાણું પૂરવાની દર્શિએ પણ જીપરનો ક્રમ જ સહજ છે. પછી જેણે જે પુસ્તક યોગ્ય લાગે તે તે ચલાવે. જ્યારે સ્વભાવનાં

જ સમર્પ પુસ્તક હશે ત્યારે તે સહજ રીતે પસંદગી પામશે, છતાં બીજાં આન્તિય ભાષાઓનાં અને અંગ્રેજ પુસ્તકોની ભલામણું અધ્યાપક કર્યા વિના રહેવાના જ નહિ અને ખરા વિદ્યાર્થીઓ તે વાંચવાના પણ.

૫. પ્રાર્દેશિક ભાષા ન જાણુનાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ હિંદી તો શીખ્યા જ હશે, ડેમ કે તેતું રથાન અનિવાર્ય છે. એટલે જ્યાં તેઓ જશે ત્યાં હિંદી મારફત શીખવશે કે શીખશે. તેમ છતાં કે પ્રાર્દેશિક બોધભાષા આગંતુક વિદ્યાર્થીને તદ્ત અનિષ્ટી હશે તે ભાષા તે વિદ્યાર્થી ત્યાં જરૂર શીખ્યી દે એ જ ચાલુ શિરસ્તો છે. આજે પણ અંગ્રેજ જાણુનાર ક્રાંતિ, જર્મની કે રશિયા જાય છે તો તે શું કરે છે? વળી ગુજરાતી કે મરાગીભાષી બંગાળી દ્વારા અપાતું શિક્ષણ લેવા જાય લારે કલકત્તા અને શાન્તિનિકેતનમાં શું કરે છે?

વિદેશના વિદ્યાર્થીઓ અહો આવે છે તો પણ જરૂર હોય લાં એ જ ક્રમ સ્વીકારે છે.

૬. સ્વભાવા સાથે હિંદી ભાષા માધ્યમિક રાણામાંથી ડેક સુધી અનિવાર્ય રહેવાની. પણ સરકારી નોકરીઓમાં મુશ્કેલી શી રીતે આવે એ સમજતું જ નથો. આટાં વર્ષો હિંદી શીખ્યો હોય તે સામાન્ય જુદ્ધિનો ભાષ્યસ પણ સરકારી કામડાન પૂરતી હિંદીની તાતીમ પામે છે, ડેમ કે હિંદી ડાઈ બીજા અંદરી અગ્ર સ્વભાવાથી સાવ વેગજી ભાષા છે જ નહિ. દ્રાવિડી ભાષાઓ ભેદનાર પણ હિંદી સરલતાથી શીખ્યી લે છે અને જ્યારે તે અભ્યાસકાળમાં અનિવાર્ય શિખાઈ હોય તારે તો તેને મારે પણ તે તદ્ત વ્યવહારક્ષમ બની જાય છે.

૭. ભાષાની એકતા એ વ્યવહારની એકતા અને સરળતાનું સાધન છે. દેશની એકતા એ જુદી વરતું છે. તે તો દેશ પ્રત્યેની જવાઅધારી અને કર્તવ્યનિષ્ઠાથી જ સાંધી શકાય. પણ ધારો કે ભાષા જ દેશની એકતાનું ખાસ સાધન છે એમ માનીએ, તો પણ રાષ્ટ્રીય ભાષા લેખે પ્રથમથી ડેક સુધી હિંદી ભાષા છે જ અને સરકારી વહીવરટમાં તે રહેવાની. એટલાથી એકતા સધારો જ. ને એમ માનીએ કે બોધભાષા લેખે બીજી ભાષાઓ ચાલે તેટલા પૂરતી એકતા ખાંડિત થાય તો તો એમ માનવું રહ્યું કે બોધભાષા ન રાખવા છતાં આખા દેશની જનતામાં સારી એકતા મારે પ્રાન્તીય ભાષાઓનો લોપ જ કરવો પડે; નહિ તો એટલે અંશે પ્રાન્તીય ભાષાઓ જીવતી હશે તેટલે અંશે દેશની એકતા ખાંડિત થવાની. મારી દૃષ્ટિ દેશની એકતાના પ્રશ્નને બોધભાષા સાથે સંદર્ભિત કરી બનાવ્યા છે.

—સંસ્કૃતિ, અધ્રિત ૧૬૫૪.